https://archive.org/details/bk1193/page/n0/mode/1up

All Items on https://archive.org/details/realpatidar
realpatidar.com
Full Library on https://realpatidar.com/library

સપ્ટેમ્બર-૨૦૨૨

પાટીદાર સૌરભ

ત્રિવાર્ષિક લવાજમ રૂ. ૪૫૦

કેન્દ્રીય સમાજના આગામી
મહોત્સવના ચેરમેનપદે
ગોપાલભાઇ ભાવાણી

પોકાર પરિવારના નવા કર્ણધારો વરાયા

ઋણાનુબંધ

વિરાણી મોટીમાં જ્ઞાતિ સુધારકોની પ્રતિમાઓનું અનાવરણ

દયાપરના વાગડિયા દંપતીનું
જીવતે જગતિયું !

realpatidar.com

રામપર (સરવા)માં લક્ષ્મીનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી

https://archive.org/details/bk1193/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

https://archive.org/details/bk1193/page/n2/mode/1up

2022-09 -Patidar Saurabh -Ratanshi Khimji -Idol Inauguration (1193)

https://archive.org/details/bk1193/page/n3/mode/1up

realpatidar.com

પાટીદાર સૌરભ

દીપોત્સવી વિશેષાંક
૨૦૨૨

આપ સુવિદીત હશો જ કે પાટીદાર સૌરભ માસિક કચ્છ કડવા પાટીદાર સમાજના લોકો માટે છેલ્લા ૩૧ વર્ષથી નખત્રાણા ખાતેથી પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યું છે.

કચ્છની કડવા પાટીદાર જ્ઞાતિના કચ્છ અને કચ્છ બહાર ભારતમાં વસતા લોકોના સમાચારો ઉપરાંત જ્ઞાતિ સમુદાયના જીવન ઘડતરમાં ઉપયોગી થઈ શકે તેવા વિચારશીલ લેખો અને જ્ઞાતિના આર્થિક, સામાજિક તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રના સમાચારો આ મેગેઝીનમાં આપવામાં આવે છે. કચ્છના ગામડાઓની વિગતવાર માહિતી અને પ્રાસંગિક ફોટાઓ પણ દરેક અંકમાં અવારનવાર આપવામાં આવે છે.

આપને જણાવતાં આનંદ થાય છે કે ગયા વર્ષની જેમઆ વર્ષે પણ પાટીદાર સૌરભનો ઓક્ટોબર-નવેમ્બર-૨૦૨૨નો અંક દીપોત્સવી વિશેષાંક તરીકે બહાર પાડવામાં આવી રહ્યો છે. બહુરંગી ટાઈટલ પેજ સાથે સંપૂર્ણ ઓફસેટમાં છપાનારા આ વિશેષાંકમાં અત્યાર સુધી ક્યાંયે પ્રસિદ્ધ ન થયા હોય તેવા લેખો, વાર્તાઓ, કાવ્યો અને પાટીદાર સમાજની અલભ્ય માહિતીનો રસથાળ વાચકોને પીરસવામાં આવશે.

ખાસ દીપોત્સવી અંક બહાર પાડવાનો હોવાથી અમે આપની પાસેથી જાહેરાતની અપેક્ષા રાખીએ છીએ. જેથી આ અંકમાં આપના ધંધાની જાહેરાતો અને શુભેચ્છા જાહેરાતો મોકલાવી સહકાર આપવા અનુરોધ કરીએ છીએ.

જાહેરાતના દર નીચે મુજબ છે

આખું પાનું (રંગીન)	રૂા.૬૦૦૦
આખું પાનું (B&W)	રૂા.૩૦૦૦
અડધું પાનું (B&W)	રૂા.૧૬૦૦
પા પાનું (B&W)	રૂા.૮૫૦

દીપોત્સવી અંકની વિગત
અંકની સાઈઝ ૧૯ X ૨૬ સે.મી.
પ્રિન્ટ એરીયા ૧૭ X ૨૩ સે.મી.

વધુ માહિતી માટે સંપર્ક કરો.
patidarsaurabh24@gmail.com
M.9724839106 પર કોલ કરો.

realpatidar.com

https://archive.org/details/bk1193/page/n4/mode/1up

realpatidar.com

તંત્રીલેખ

વિસરાઈ ગયેલાં ઈતિહાસને સજીવ કરવાની કવાયત

કોઈ પણ સમાજની વર્તમાન પેઢીને પોતાની જ્ઞાતિના ઈતિહાસનું જ્ઞાન હોવું જરૂરી છે. આપણા પૂર્વજોના પરાક્રમી કાર્યો અને દીર્ઘદ્રષ્ટિભર્યા નિર્ણયોને કારણે આજે આપણે ઉજળા છીએ તે હકીકતનો અહેસાસ સમાજની નવી પેઢીને ન હોય તો તે કરાવવો અતિ જરૂરી છે.

આપણા સમાજનો ઈતિહાસ તો ખૂબ રોમાંચક અને વડીલોની સંઘર્ષ ગાથાઓથી ભરેલો છે. સૈયદો અને ગેઢેરાઓના જૂલ્મની કથાઓ અને આવા પ્રપંચીઓ સામે લડત ચલાવી સમગ્ર સમાજને જાગૃત કરી વિધર્મીઓની ચૂંગાલમાંથી જ્ઞાતિને છોડાવનારા આદ્યસુધારકોની જીવનકથનીઓ વાંચીએ ત્યારે આજે પણ આપણા રૂંવાટા ઉભા થઈ જાય છે.

કચ્છ કડવા પાટીદાર સમાજમાં ૧૦૦-૧૨૫ વર્ષ પહેલાં થયેલ સામાજિક અને ધાર્મિક ક્રાંતિના વિગતવાર અહેવાલો પુસ્તિકા સ્વરૂપે આજે પણ જોવા મળે છે. તે વખતના જ્ઞાતિના કાર્યકરોએ આ અહેવાલો પ્રસિદ્ધ કરવા ઉઠાવેલી જહેમત ઉડીને આંખે વળગે તેવી છે. પણ કમભાગ્યે ૧૯૬૦ પહેલાંના ત્રણ-ચાર દાયકાના કોઈ ખાસ અહેવાલો જોવા મળતા નથી. આ સમયગાળા દરમિયાન જ્ઞાતિમાં જબ્બર ક્રાંતિ થઈ છે પણ ગ્રંથસ્થ કરવાની કામગીરી પૂરતા પ્રમાણમાં થઈ નથી.

કચ્છ કડવા પાટીદાર સમાજના ઈતિહાસમાં એવા ઘણા પાત્રો છે જેમને તેમના વિરાટ કાર્યોની તુલનામાં પૂરતો ન્યાય મળ્યો નથી. આવા વિસરાઈ ગયેલા ઈતિહાસને સજીવ કરવાનો પ્રયાસ વિરાણી મોટી સમાજે કર્યો છે અને સમાજ સુધારક સંત ઓધવરામજી મહારાજ અને ક્રાંતિવીર રતનશી ખીમજી ખેતાણીની પ્રતિમાનું અનાવરણ કરી તેમનું ઋણ ઉતારવાનું આવકારદાયક કાર્ય કર્યું છે તે માટે વિરાણી મોટી સમાજ અભિનંદનને પાત્ર છે.

કચ્છ કડવા પાટીદાર સમાજને વિધર્મી એવી સતપંથી વિચારસરણીમાંથી બહાર લાવવા કચ્છમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું સૌ પ્રથમ મંદિર બનાવવામાં પાયાના પથ્થર એવા સંતવીર પ.પૂ.ઓધવરામજી મહારાજ તથા ક્રાંતિવીર રતનશી ખીમજી ખેતાણીની પ્રતિમાઓ વિરાણી ગામમાં એજ જીર્ણોદ્ધાર કરેલ મૂળ પૌરાણિક મંદિરમાં પ્રસ્થાપિત કરી વિરાણી સમાજ દ્વારા ગયા મહિને ઋણાનુબંધ કાર્યક્રમ યોજીને વિસરાયેલા ઈતિહાસને સજીવ કરવાની પહેલ થઈ છે તે આવકારકદાયક છે.

પીરાણાના પાખંડમાંથી જ્ઞાતિને છોડાવવાની ચળવળમાં જે તે સમયે જ્ઞાતિના ઘણા બધા વીરલાઓ અને વીરાંગનાઓએ યોગદાન આપ્યું છે. કેટલાક નામો ઉજાગર થયા છે તો એવા ઘણાય નામો છે કે ઈતિહાસકારોની નજરમાંથી દૂર રહી ગયા છે. આવા ભૂલાઈ ગયેલા પાત્રોને શોધીને વર્તમાન પેઢી સમક્ષ મૂકવાનું કાર્ય જ્ઞાતિના ઈતિહાસકારો દ્વારા હાથ ધરાય તે ખૂબ જરૂરી છે.

આપણા સમાજમાં આવી ઐતિહાસિક બાબતોમાં ખણખોદ કરી માહિતી એકઠી કરવામાં મુંબઈ રહેતા સી.એ. ચંદ્રકાંતભાઈ છાભૈયા પાવરધા છે. પૂ.ઓધવરામજી મહારાજ અને રતનશી ખીમજી ખેતાણીના ઈતિહાસને ઉજાગર કરવામાં પણ તેમની પ્રમુખ ભૂમિકા રહી છે. ઉમા દર્પણના તંત્રી અને સાહિત્કાર રતિલાલ પોકાર જેવા વિદ્વાનો જો આ જવાબદારી સ્વીકારે તો સમાજને ઘણું બધું નવું જાણવા મળી શકે. પણ આ કાર્ય તટસ્થતાપૂર્વક થાય તે પણ જરૂરી છે, નહિં તો સમાજમાં તેના વિપરીત પ્રત્યાઘાત પણ પડી શકે છે.

■

realpatidar.com

https://archive.org/details/bk1193/page/n5/mode/1up

2022-09 -Patidar Saurabh -Ratanshi Khimji -Idol Inauguration (1193)

વિરાણીમોટી સમાજે વિસરાઈ ગયેલ ઈતિહાસને સજીવ કર્યો

સમાજ સુધારક સંત ઓધવરામજી મહારાજ અને ક્રાંતિવીર રતનશી ખીમજી ખેતાણીની પ્રતિમાનું અનાવરણ

કચ્છ કડવા પાટીદાર સમાજમાં સનાતન ધર્મની જ્યોત પ્રજ્વલિત કરનાર સંતવીર પ.પૂ.ઓધવરામજી મહારાજ તથા ભેખધારી ક્રાંતિવીર વડીલ શ્રી રતનશી ખીમજી ખેતાણીની પ્રતિમાનું અનાવરણ કરવા સાથે વિરાણીમોટી સમાજ દ્વારા ઋણાનુબંધ કાર્યક્રમનું ભવ્ય આયોજન તા.૧૯-૮-૨૦૨૨ના સમાજવાડી મધ્યે કરવામાં આવ્યું હતું.

આપણી સમાજને વિધર્મી એવી સતપંથ વિચારસરણીમાંથી બહાર લાવવા કચ્છમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું સૌ પ્રથમ મંદિર બનાવવામાં પાયાના પથ્થર એવા સંતવીર પ.પૂ.ઓધવરામજી મહારાજ તથા ક્રાંતિવીર રતનશી ખીમજી ખેતાણીની પ્રતિમાઓ એજ જીર્ણોદ્ધાર કરેલ મૂળ પૌરાણિક મંદિરમાં વિરાણી સમાજ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલ છે.

જ્ઞાતિ સુધારકોની પ્રતિમાને હારારોપણ કરતા પ્રખર સનાતની હિંમતભાઈ ખેતાણી.

આ પ્રતિમાઓનું અનાવરણ કેન્દ્રીય સમાજના પ્રમુખ અબજીભાઈ કાનાણીના સાન્નિધ્યમાં રતનશી બાપાના પરિવારજનો દ્વારા વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયના પ્રમુખ હંસરાજભાઈ ધોળુ અને સંસ્કારધામના વડા ગંગારામભાઈ રામાણી પણ આ ઐતિહાસિક પ્રસંગમાં સહભાગી બન્યા હતા.

વિરાણીમોટી સમાજના પ્રમુખ લખમશીભાઈ વિશ્રામભાઈ તેજાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ ઋણાનુબંધ સભાની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવેલ. સમાજના ઉપપ્રમુખ શંકરલાલ કાનાણીએ પધારેલ મહેમાનોનું સ્વાગત કરતાં વરસાદને કારણે મહેમાનોને અગવડતા પડી હોય તો ક્ષમાયાચના કરેલ.

કેન્દ્રીય સમાજના પ્રમુખ અબજીભાઈ કાનાણી કે જેમણે સનાતની ચંદ્રકાન્ત છાભૈયાના સહકારથી સનાતન મુહિમમાં રતનશી ખીમજી ખેતાણીના અનન્ય યોગદાનનો વીસારે પડી ગયેલા ઈતિહાસનું સંશોધન કરી આજના ઋણાનુબંધ કાર્યક્રમ દ્વારા ઋણ સ્વીકારના આ કાર્યક્રમને

જ્યારે સનાતની ચળવળના બંને સમાજ સુધારકના માર્ગ અલગ થયા

રતનશી ખીમજી ખેતાણીનો સંપર્ક સંતવીર ઓધવરામજી મહારાજ સાથે થતા, નારાણજી રામજી લીંબાણીની સનાતની મુહિમને ગતિવાન બનાવવા કડક નિયમોના બદલે વ્યવહારુ નિયમો જેવા કે ઈષ્ટદેવ તરીકે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણને પ્રસ્થાપિત કરી ગામે ગામ મંદિરો બંધાવવાનો આદેશ સંત ઓધવરામ મહારાજે કરેલ. આ વિચારસરણીમાં નારાયણજી રામજી લીંબાણી સહમત ન થતાં સનાતની મુહિમના બંને સમાજ સુધારકોના માર્ગ અલગ થયા...

ત્યાર બાદ પાટીદાર ગામોમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના મંદિરો બાંધવાની શરૂઆત થઈ. સનાતનીઓને સંગઠીત કરવા વર્ષ ૧૯૩૯માં કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજની રચના રતનશી બાપા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી. રતનશી બાપા તે સમાજના પ્રથમ પ્રમુખ બન્યા. ગામે ગામ સનાતનનો પ્રચાર કરી મંદિર બાંધવા જ્ઞાતિજનોને જાગ્રત કર્યા અને તન-મન-ધનથી મદદ કરી. આ મુહિમ નબળી ન પડે તે માટે રતનશી બાપાએ તેમની મુંબઈ ખાતેની કિંમતી મિલ્કતો વેચીને પણ સમાજ અને ધર્મ માટે આર્થિક યોગદાન આપ્યું હતું.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1193/page/n6/mode/1up

2022-09 -Patidar Saurabh -Ratanshi Khimji -Idol Inauguration (1193)

realpatidar.com

'ઋણાનુબંધ' કાર્યક્રમને ખુલ્લો મુક્તા હિંમતભાઈ ખેતાણી અને વિરાણી સમાજના આગેવાનો.

કેન્દ્રમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓની વિગતો આપેલ.

રતનશી બાપા અને સંત ઓધવરામ મહારાજનો ઈતિહાસ ઉજાગર કરવા જહેમત ઉઠાવનાર વિઝન ડેવલપમેન્ટ કમિટિના વાઈસ ચેરમેન ચંદ્રકાન્તભાઈ છાભૈયાએ રતનશી બાપા અને સંત ઓધવરામ બાપા દ્વારા થયેલ કાર્યોના કેટલાક રોચક કિસ્સાઓ રજૂ કરતાં ઉપસ્થિત શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. મોહિમ છેડવી એના કરતાં મોહિમને સમાજ લાભમાં ફેરવવી એ વધારે મુશ્કિલ હોય એ બાબતે ધ્યાન દોરતાં તેમણે જણાવેલ કે, રતનશી બાપા અને ઓધવરામ મહારાજની જોડીએ ધર્મ, જ્ઞાતિ, શિક્ષણ, આર્થિક અને સામાજિક મુદ્દાઓ પર કામ કરી જે સનાતન સમાજ ઉભી કરી, એ સમાજના મીઠા ફળ આજે આપણે ખાઈ રહ્યા છીએ.

માત્ર ત્રણ ધોરણ સુધી ભણેલા અને ૧૪ વર્ષની કોમળ વયે ધર્મના કાર્યમાં ઝંપલાવનાર રતનશી બાપા અને સંત ઓધવરામ બાપાએ ઈષ્ટદેવ ભગવાન લક્ષ્મીનારાયણ આપીને, આપણને વિધર્મમાંથી સફળતાપૂર્વક છોડાવ્યા, આપણને હિન્દુ ઓળખ આપી. મૂળ કડવા પાટીદાર જ્ઞાતિમાંથી છૂટી પડેલ આપણી

મૂર્તિમંત કર્યો હતો. અબજીભાઈએ આ કાર્યક્રમની પ્રસ્તાવના આપતા જ્ઞાતિ સુધારક આદરણીય નારાણજી રામજી લીંબાણીની લડતમાં રતનશી બાપાએ જોડાઈને કરેલ કાર્યોને યાદ કર્યા હતા, સાથે સાથે સનાતની લડતમાં વિશિષ્ટ યોગદાન આપનાર આટલી મોટી હસ્તીનો ઈતિહાસથી વિમુખ રહી જવા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો.

કચ્છનું સૌ પ્રથમ લક્ષ્મીનારાયણ મંદિર વિરાણીમોટી મધ્યે બનાવવા બદલ ઋણ સ્વીકાર તરીકે એજ મંદિરમાં સંતવીર ઓધવરામજી મહારાજ અને ક્રાંતિવીર રતનશી બાપાની પ્રતિમાનું અનાવરણ કરી સમગ્ર પાટીદાર સમાજને વિસરાયેલા ઈતિહાસ ઉજાગર કરવાનો નમ્ર પ્રયત્ન વિરાણી સમાજે કર્યો છે. વિરાણી ગામની લાગણી અને માંગણીને વાચા આપતા અબજીભાઈએ સંસ્કારધામથી આવેલ વડીલોનું ખાસ ધ્યાન દોર્યું હતું કે, જે વ્યક્તિના કારણે આપણને લક્ષ્મીનારાયણ ભગવાન ઈષ્ટદેવ તરીકે મળ્યા હોય, એવી વ્યક્તિની પ્રતિમાનું યોગ્ય સ્થાન સમસ્ત લક્ષ્મીનારાયણ મંદિરોના કેન્દ્રસ્થાન એવા સંસ્કારધામમાં હોવું જોઈએ, જેથી આવનાર પેઢીને સમાજના ઈતિહાસની જાણ થાય અને પ્રેરણા મળે.

ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ હંસરાજભાઈએ અબજીભાઈની સૂચનાને આવકાર આપતા સંસ્કારધામ મુકામે આવા સમાજ સુધારક મહાનુભાવોની પૂર્ણ કદની પ્રતિમા મુકવી જોઈએ એવો મત વ્યક્ત કરી આ અંગે સંસ્કારધામના અન્ય આગેવાનોને વિશ્વાસમાં લઈ ટૂંક સમયમાં જ યોગ્ય કરવા આશ્વાસન આપેલ હતું. આ વાતને સંસ્કારધામના પ્રમુખ ગંગારામભાઈએ પણ ટેકો આપેલો અને



કાર્યક્રમના સ્વપ્નદૃષ્ટા એવા કેન્દ્રીય સમાજના પ્રમુખ અબજીભાઈ કાનાણી.

realpatidar.com

https://archive.org/details/bk1193/page/n7/mode/1up

realpatidar.com

જ્ઞાતિને મૂળ જ્ઞાતિ સાથે જોડવા વાંઢાય ખાતે ઉમિયા માતાજીનું મંદિર બનાવવા મહત્ત્વની ભૂમિકા ભજવી, આપણને જ્ઞાતિ ગૌરવ અપાવ્યું.

શૈક્ષણિક ક્ષેત્રે આપણી જ્ઞાતિ ખૂબ પછાત હોવાથી તેમાં સુધારો લાવવા છાત્રાલયો બનાવવાની વાતો થવા લાગી અને તા.૨૯-૭-૧૯૪૫ના ભુજ ખાતે છાત્રાલય બનાવવાનું નક્કી કરવામાં આવ્યું અને તેના માટે માતબર ફાળો પણ ભેગો કરવામાં આવેલ. તેવી જ રીતે આર્થિક રીતે આપણી જ્ઞાતિનું થતું શોષણ રોકવા ઉઠાવેલ પગલાની સુંદર જાણકારી આપી. આપણને સંગઠીત કરવા માટે સૌ પ્રથમ શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજની સ્થાપના કરી અને તેના પ્રથમ પ્રમુખ રતનશી બાપા બન્યા. આવી રીતે સંગઠિત થયાની સારી અસર જ્ઞાતિ પર પડી અને લોકો બહોળી સંખ્યામાં સતપંથ છોડી સનાતની બન્યા. ઉપરોક્ત વિસ્તૃત જાણકારી ચંદ્રકાંતભાઈએ સભાને આપેલ.

ઓધવરામ મહારાજની સતપંથના જમાતખાના ઉર્ફે ખાનામાં જ હિન્દુ મંદિર ઉભું કરવાની રાજનીતિના ખૂબ વખાણ કરીને વિરાણી ગામને સૂચન કર્યું કે ભવિષ્યમાં ગમે તેટલા ફેરફારો કરો, પણ મંદિર એવું જ રાખજો, જેથી કરીને ભાવિ

જ્ઞાતિ સુધારકોની પ્રતિમા સાથે ખેતાણી પરિવારના સભ્યો

પેઢીને ગૌરવ થાય. ધનસુરા ખાતે છાત્રાલય ઉભું કરવા માટે જ્યાં સુધી જરૂરી રકમ દાન સ્વરૂપે ના મળે ત્યાં સુધી હીરાપુર કંપામાં એક પગે ઉભા રહેવાની ટેક સંત ઓધવરામ મહારાજે લીધી અને છેલ્લે ખૂટતી રકમની વ્યવસ્થા કરવાની જવાબદારી રતનશી બાપાએ લીધી એ ઘટનાનું સુંદર વિવરણ પણ ચંદ્રકાંતભાઈએ કરેલ.

એ સમયના સતપંથી આગેવાનો, મુખીઓ અને ગેઢેરાઓ દ્વારા સનાતનીઓ ઉપર ગુજારવામાં આવતા અત્યાચારો અને પ્રચાર કાર્યમાં નીકળતા આપણા આગેવાનો પર થતા પથ્થરમારા સહન કરીને પણ સનાતની મુહિમને આગળ ધપાવવા ખંતથી લાગેલા આ બંને વડીલોની ચંદ્રકાંતભાઈએ ખૂબ રસપ્રદ અને પ્રેરણાદાયી વાતો કરી, જેને સભાએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધેલ.

કેન્દ્રીય સમાજના ટ્રસ્ટી ગોપાલભાઈ ભાવાણીએ તેમની આગવી શૈલીમાં જણાવેલ કે, વિરાણીની ભૂમિએ આપણી સમાજને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે પથદર્શક મહાનુભાવો આપ્યા છે. ભુલાઈ ગયેલ ઈતિહાસ ઉજાગર કરતો કાર્યક્રમ કરવા બદલ વિરાણી સમાજને અભિનંદન આપ્યા હતા.

કેન્દ્રીય સમાજ અને વિરાણી સમાજના પૂર્વ પ્રમુખ રામજીભાઈ નાકરાણીએ રતનશી બાપાની પ્રતિમા કડવા પાટીદાર સમાજના તમામ સંકુલોમાં હોવી જોઈએ તેવું ભારપૂર્વક નિવેદન કરેલ. અબડાસા વિસ્તારના ધારાસભ્ય અને વિરાણી મોટી ગામના વતની પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ પરિવાર વતી અમારા પૂર્વજો દ્વારા જે તે સમયે મંદિર બનાવવા થતી નડતરનો ઉકેલ લાવવા કરેલ પ્રયત્નોને યાદ કરી પોતે પણ સમાજ ઉપયોગી કોઈ પણ કામ માટે તત્પર હોવાનું જણાવેલ.

સમારોહમાં ઉપસ્થિત જ્ઞાતિના ભાઈ-બહેનો.

રતનશી બાપાના સુપુત્ર પ્રખર

realpatidar.com

https://archive.org/details/bk1193/page/n8/mode/1up

2022-09 -Patidar Saurabh -Ratanshi Khimji -Idol Inauguration (1193)

realpatidar.com

સનાતની એવા હિંમતભાઈ ખેતાણી કાર્યક્રમ બાબતે પ્રતિભાવ આપતા ભાવવિભોર થઈ ગયા હતા અને વધારે બોલી શક્યા નહોતા પણ આવેલ તમામ મહાનુભાવોનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો.

વિરાણી સમાજના પ્રમુખ લખમશીભાઈ તેજાણીએ વિરાણી મોટીના આંગણે યોજાયેલ ઋણાનુબંધ કાર્યક્રમના અનેરા અવસરે ઉપસ્થિત કેન્દ્રીય સમાજની તમામ સંસ્થાઓના કર્ણધારોનો આભાર માની ક્યાંય પણ જરૂર પડે તો અમારી સમાજ હંમેશા આપની પડખે ઉભી રહેશે તેવી બાંહેધરી આપેલ.

આવેલ મહેમાનોનું શાલ ઓઢાડી વિરાણી સમાજના હોદ્દેદારો અને આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ કાર્યક્રમને સફળ બનાવવા વિરાણી સમાજ, યુવા મંડળ અને મહિલા મંડળના હોદ્દેદારો અને કાર્યકરોએ ખૂબ જહેમત ઉઠાવેલ.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય સમાજના ટ્રસ્ટી નાનજીભાઈ રામાણી, મહિલા સંઘના પ્રમુખ યશોદાબેન નાકરાણી, પશ્ચિમ કચ્છ ઝોન સમાજના પ્રમુખ રતનશીભાઈ ભીમાણી તેમજ રતનશી બાપાના સુપુત્રો કનુભાઈ અને ચંદ્રકાંતભાઈ, વિરાણી સમાજના પૂર્વ પ્રમુખ માવજી વસ્તા રૂડાણી અને નારણ પુંજા માનાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેલ.

વિરાણી સમાજના પ્રમુખ શંકરલાલ કાનાણીએ સભાનું સંચાલન કરેલ જ્યારે આભારવિધિ મહામંત્રી હિંમતભાઈ સોમજીયાણીએ કરેલ. ❖

પ્રાર્થના - ધ્યાન દ્વારા ભગવાન સાથે વાત કરો

તમે નિયમિત પ્રાર્થના કરો. ઊંઘ, ભૂખ અને સેક્સની જેમ જ પ્રાર્થનાને જીવનનો ભાગ બનાવો. પ્રાર્થના વૃક્ષ પરનું સુગંધી ફૂલ છે, ચૈતન્યની વસંત છે. આપણું રોજિંદું જીવન અહંયુક્ત છે. પ્રાર્થનામાં નરી નમ્રતા, કરુણા અને મોરપિચ્છની સુંવાળપ છે. પ્રાર્થના કંઈક લેવા માટે નહીં, આપવા માટે છે. પ્રાર્થના તમારે જ કરવાની છે. તે ઉછીની નહીં ચાલે. પ્રાર્થના દ્વારા ધ્યાનસ્થ થઈને ભગવાન સાથે વાતો કરવાની છે. ઈશ્વરને તમારા હૃદયમાં સ્થાન આપવાનું છે. મનુષ્ય તરીકે તમારા અસ્તિત્વ માટે ઈશ્વરનો આભાર માનવાનો છે. પંખી ટહુકીને, ફૂલ ખીલીને આભાર માને છે. તમારામાં ઈશ્વરનો પ્રવેશ થયા કરે તે માટે પ્રાર્થના કરો. તમે કેવી પ્રાર્થના કરી છે તે સાંભળીને ઈશ્વર તેનો જવાબ ચોક્કસ આપશે. તે માટે અધીરા થતા નહીં. પ્રાર્થના દ્વારા તમે શાંત રહીને અંદર તમને જ સંભળાય તે રીતે બોલો છો. તમે જ્યારે ચોક્કસ વિચારોનું સતત, એકધાર્યું પુનરાવર્તન કરતા રહો છો ત્યારે તેમાંથી શક્તિશાળી ઊર્જા પેદા થાય છે. વિચાર એ ઈલેક્ટ્રોમેગ્નેટિક-વિદ્યુતચુંબકીય-ક્રિયા છે. તમે જ્યારે હકારાત્મક, શુભ વિચારોનો વારંવાર વિચાર કરતા રહો છો. પોતાના સિવાયની વ્યક્તિ કે વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરો છો ત્યારે તે વિચાર પોતાનું એક મજબૂત ચુંબકીય ક્ષેત્ર ઊભું કરે છે જેનો તમને અનુભવ થયા વિના નહીં રહે...

પ્રાર્થના આજના દિવસની ચાવી છે અને રાત્રે સૂવાના સમયે મનને આપવાનું તાળું છે. સવારે પથારીમાંએથી ઊભા થતાં પહેલા ઈશ્વરને યાદ કરો. પૂ. પાંડુરંગ શાસ્ત્રી સવારે પ્રેરણાદાયી મંત્રોનું સ્મરણ કરવા કહે છે.

કરાગ્રે વસતે લક્ષ્મીઃ કરમૂલે સરસ્વતી ।
કરમધ્યે તુ ગોવિંદઃ પ્રભાતે કરદર્શનમ્ ॥

આ શ્લોક તમે બોલશો ત્યારે કરમાં-હાથમાં રહેલી શક્તિને યાદ કરશો. આત્મવિશ્વાસને નિમંત્રણ આપશો. તમારા હાથમાં તો ખુદ લક્ષ્મી, સરસ્વતી અને ગોવિંદ વસેલાં છે. તેમનું નિત્ય સ્મરણ કરશો, તો દરરોજ તમારામાં આશા અને ઉત્સાહ, હિંમત અને હામનો પ્રાણસંચાર થશે. નિરંજન ભગત હાથ કેળવવાની ખૂબ સરસ વાત કરતા કહે છે :

'આપણા આ બેય ખાલી હાથમાંયે કેટલું છે.
આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો
અરે, એના વડે આવો. પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ
અને બિનઆવડતે સારું-નઠારું કેટલુંયે કામ કરતા
આપણા આ હાથ કેળવીએ !'

આપણા દેશમાં એટલે જ ધ્યાન, નામસ્મરણ, મંત્રજાપનું મહત્ત્વ છે. હૃદયના સંપૂર્ણ ભાવ, શ્રદ્ધા સાથે પ્રાર્થના કે ધ્યાન કરવાથી સુખ, શાંતિ, સમજણ અને સંતોષનો અનુભવ થશે. મનનું તોફાન શમી જશે. રઝળપાટ અટકી જશે. પાનખરમાં જેમ ઝાડનાં પાંદડાં ખરી પડે છે તેમ આધિ, વ્યાધિ અને ઉપાધિ ખરી પડશે. પુરુષાર્થ દ્વારા તમે ભૌતિક સુખ મેળવો છો. જ્યારે પ્રાર્થના દ્વારા સજીવસુખ, આનંદ, પ્રેમ પ્રાપ્ત કરો છો.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com